

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનના સંગીતકારો કેનેડાના ટોચના સંગીત ઉત્સવો પૈકી એકમાં પોતાના સંગીત સૂરોની રમઝટ બોલાવશે

ધિસ ઈઝ બ્રેમ્પટન (This is Brampton) @NXNE શુક્રવાર, જૂન 7 નાં રોજ યોજાશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 24, 2019) – તમારા સંગીત જલસા માટેના વસ્ત્રો (કન્સર્ટ આઉટફિટ) પહેરીને જીવંત સંગીતની મહત્વની રાત્રીનો આનંદ માણવા તૈયાર થઈ જાવ, જેમાં બ્રેમ્પટનના શ્રેષ્ઠ ઉભરતા પ્રતિભાશાળી સંગીતકારો ભવ્ય સંગીત રજૂ કરશે!

This is Brampton (ધિસ ઈઝ બ્રેમ્પટન)નો 2019 North by Northeast (NXNE) કાર્યક્રમ શુક્રવાર, જૂન 7 નાં રોજ, રાત્રે 9 વાગ્યે યોજાશે. આ વર્ષનું શોકેસ (પ્રદર્શન) ટોરોન્ટોના મુખ્ય જીવંત સંગીત સ્થળો પૈકી એકમાં યોજાશે, The Hideout (ધી હાઈડઆઉટ) જે ટોરોન્ટોમાં અહીં સ્થિત છે: 423 College Street (કોલેજ સ્ટ્રીટ) પર.

This is Brampton @NXNE એ બ્રેમ્પટનના કલાકારો અને ઔદ્યોગિક નિષ્ણાતોની પેનલે પસંદ કરેલું, સ્થાનિક પ્રતિભાઓ દર્શાવતું પ્રદર્શન છે. કેનેડાના ટોચના સંગીત ઉત્સવો પૈકી એકમાં સ્ટેજ પર જીવંત પ્રસારણ કરતા આપણાં શહેરના નિષ્ણાત અને ઉભરતા સંગીતકારોનું સંગીત માણવા દરેક વ્યક્તિને નિમંત્રણ આપવામાં આવે છે.

આ વર્ષના *This is Brampton* પ્રદર્શનની લાક્ષણિકતાઓ છે:

ઝેની-સોલ (ZeneSoul)

એક ઉભરતી સ્વતંત્ર R&B કલાકાર અને ગીતકાર, ઝેની-સોલે તેણીની સંગીત કારકિર્દીની શરૂઆત 2018 ની ઓગસ્ટમાં પોતાના પહેલા સિંગલ આલ્બમ “Pricey” (પ્રાઈસી)થી કરી હતી. 2019 નાં માર્ચમાં, ઝેની-સોલે તેણીની પહેલી EP, “WORTH” (વર્થ) રજૂ કરી હતી.

કેઈ મ્યુઝિક (Kaë Music)

આઈકોનિક ટોરોન્ટો રેગી (reggae) બેન્ડનો એક ભૂતપૂર્વ ભાગ, ધી સેન્સેશન બેન્ડ, કેઈ મ્યુઝિકે ડિસેમ્બર 2015 માં બે ક્વરના સિંગલ આલ્બમ્સ રજૂ કર્યાં. તેણીએ પોતાનું પહેલું અસલ સિંગલ આલ્બમ ડિસેમ્બર 2016 માં લખીને રજૂ કર્યું, જેનું નામ હતું “ધી સ્ટ્રગલ ઈઝ રીયલ (The Struggle is Real)”, અને તેણી હાલમાં પોતાના EP પર કામ કરી રહી છે.

રીકો રિફ્ફે (Reeko Rieffe)

હેઈટી વંશીય મૂળના પણ બ્રેમ્પટનમાં જન્મીને, રીકો રિફ્ફે પોતે ક્રીઓલ (Creole) અને બહુસાંસ્કૃતિક અવાજો કાઢે છે. આ ઉભરતો કલાકાર 200,000 ઉપરાંત સ્ટ્રીમ્સ પ્લેટફોર્મ-વાઈડ અને YouTube પર કુલ 30,000 દર્શકો સાથે, પોતાના માટે ઓનલાઈન નામ બનાવી રહ્યો છે.

નોયઝ (Noyz), ટ્રેમેઈન (Tremayne) અને સ્કોટ્ટી ફોર (Scotty IV)

નોયઝ સ્થાનિક સંગીતકાર (MC), મિમિક્રી કલાકાર (સ્પોકન વર્ડ આર્ટિસ્ટ) અને પ્રોડ્યુસર છે. લેખન, રેકોર્ડિંગ અને સંગીતમાં પ્રવિણતા ઉપરાંત, તે સામુદાયિક માનસિક આરોગ્ય ચળવળકાર છે જે ગીતકારની રોગ મટાડવાની અને પરિવર્તનકારી શક્તિઓ મારફતે જુવાનો સાથે પ્રવૃત્તમય રહે છે.

ટ્રેમેઈન પોતાની બાંધ પર દોરેલા પોતાના હૃદય માટે જાણીતો હિપ-હોપ કલાકાર છે જે કાવ્યમય, પરંપરાગત શિકાગો હિપ હોપનું હાર્દ, અને આધુનિક ટોરોન્ટોના સમકાલીન પેચવાળા ધ્વનિતરંગોને મિશ્રિત કરે છે.

સ્કોટી ફોર GTA માં હિપ-હોપ દૃશ્યની બીજી બાજુ દર્શાવે છે. ટ્રેમેઈન અને સ્કોટી ફોર ટોરોન્ટોના સ્ટે આઉટ લેટ કલેક્ટવનો ભાગ બનાવે છે.

આ બીજુ વર્ષે હશે કે જ્યારે આપણું શહેર NXNE માં NXNE ક્લબ લેન્ડ સીરીઝના ભાગ તરીકે સહભાગી થઈ રહ્યું છે, જે કાર્યક્રમમાં ટોચના કેનેડિયન સંગીતકારો, ઔદ્યોગિક આગેવાનો અને સંગઠનો જોડાય છે. ટોરોન્ટોના કેટલાક મુખ્ય સ્થળો પર યોજાતા, આ વર્ષના ઉત્સવમાં 40 ઉપરાંત શો જોવા મળશે.

ટિકિટો વેબસાઈટ NXNE.com પર, અને ગેટ પર ઉપલબ્ધ છે. ફેસ્ટિવલ રિસ્ટ્રેન્ડની કિંમત \$29 છે અને તમામ ક્લબ લેન્ડ શોનો પ્રવેશ પૂરો પાડે છે. NXNE એક વૈશ્વિક સંગીત અને રમતોનો ઉત્સવ છે, હવે પોતાનું 25 મું વર્ષ ઉજવી રહ્યું છે, જે સમગ્ર ડાઉનટાઉન ટોરોન્ટો સ્થળોમાં યોજાય છે.

This is Brampton @NXNE વિશે વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, www.brampton.ca/NXNE.

અવતરણ (ક્વોટ):

“તકથી ભરપૂર શહેર તરીકે, સીટી ઓફ બ્રેમ્પટન આપણાં સમુદાયમાં એવોર્ડ વિજેતા કલાકારોથી માંડીને ઉભરતા કલાકારો, જેવા વિશાળ વૈવિધ્યને સહાયતા કરવામાં ગૌરવ ધરાવે છે. *This is Brampton* શોક્સ સ્થાનિક સંગીતકારો માટે તેઓ કેનેડાના ટોચના સંગીત ઉત્સવો પૈકી એકમાં શું કરી શકે છે તે દુનિયાને દેખાડવાની આશ્ચર્યચકિત તક છે.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca